



**રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી રાજસ્થાન સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લી. દ્વારા રાજસ્થાનમાં ઉદ્યોગકારો માટે રોકાણની તકો અંગે બિઝનેશ મિટિનું આયોજન કરવામાં આવેલ...**

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી રાજસ્થાન સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લી. દ્વારા રાજસ્થાનમાં ઉદ્યોગકારો માટે રોકાણની તકો વિશે જાણકારી માટે તા.૨-૧૨-૨૦૨૧ ના રોજ બિઝનેશ મીટિનું આયોજન કરવામાં આવેલ. મિટિંગની શરૂઆતમાં રાજકોટ ચેમ્બરના માનદ મંત્રીશ્રી નૌતમભાઈ બારસીયા દ્વારા ઉપસ્થિત રીકોના અધિકારીઓ તથા વિવિધ એસોસિએશનમાંથી આવેલ હોદ્દદારોને આવકારેલ. તેમજ રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને વધુને વધુ વેગ મળે અને રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય લેવેલે સિદ્ધિ પ્રાપ્ત કરે તે માટે રાજકોટ ચેમ્બર હંમેશા અગ્રેસર રહે છે. ત્યારે આ શુભ આશયથી આજરોજ રાજસ્થાનમાં રોકાણની રહેલી તકો અને સરકારી ક્ષયદાઓની સંપૂર્ણ જાણકારી મળી રહે તે માટે આ બિઝનેશ મીટિનું આયોજન કરેલ છે.

ત્યારબાદ રિકોના સિનીયર રીજીઓનલ મેનેજરશ્રી આર.સી. વૈષ્ણવ, તથા રીજીઓનલ મેનેજરશ્રી અવનીશ સોનીએ રાજકોટ ચેમ્બર દ્વારા આજ રોજ બિઝનેશ મીટિનું આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કરતા રાજસ્થાનમાં ઉદ્યોગકારો માટે રોકાણની તકો વિશે જાણકારી આપતા કનેક્ટીવીટી એડવાન્ટેજ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ભારતમાલા ઈકોનોમીક કોરીડોર, રીસોર્સ એડવાન્ટેજ, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર, પેટ્રોલીયમ-કેમીકલ્સ તથા પેટ્રોકેમીકલ્સ ઈન્વેસ્ટમેન્ટ રીજીઓન, ગેસ-ગ્રીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફીન્ટેક પાર્ક, પ્લગ એન્ડ પે ફેસેલીટી, મારવાર ઈન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર, બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઈસ પાર્ક, મેગા ટેક્સટાઈલ પાર્ક, મલ્ટી પ્રોડક્ટ SEZs, ઓનલાઈન ઈ-ઓકશનની વિગતવાર ચર્ચા કરાયેલ. તેમજ વિવિધ પોલીસીઓ જેવી કે, રાજસ્થાન ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ પોલીસી, ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન સ્કીમ, મુખ્યમંત્રી લઘુ ઉદ્યોગ પ્રોત્સાહન યોજના, સોલાર એનર્જી પોલીસી, વિન્ડ એન્ડ હાઈબ્રીડ એનર્જી પોલીસી, એગ્રો પ્રોસેસીંગ-એગ્રી બિઝનેશ અને એગ્રી એક્ષાપોર્ટ પ્રમોશન પોલીસીનું માર્ગદર્શન આપેલ. તેમજ રાજસ્થાન સરકાર દ્વારા મળવાપાત્ર વિવિધ લાભો, સહાય અને સબસીડીઓ વિગેરેની તેઓએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિત આપેલ. સાથોસાથ આગામી જ્યપુર ખાતે ૨૪ થી ૨૫ જાન્યુઆરી-૨૦૨૨ માં યોજનાર ઈન્વેસ્ટમેન્ટ સમિતિમાં ભાગ લેવા પણ અનુરોધ કરેલ.

આ બિઝનેશ મીટિંગમાં રાજકોટ ચેમ્બરના માનદ મંત્રીશ્રી નૌતમભાઈ બારસીયા, માનદ સહમંત્રીશ્રી કિશોરભાઈ રૂપાપરા, કારોબારી સભ્યશ્રી અમૃતભાઈ ગઢીયા, શ્રી ગીરીશભાઈ પરમાર, શ્રી સમીરભાઈ વેકરીયા, રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન, શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, આજી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, લઘુ ઉદ્યોગ ભારતી તથા ભાગ્યવક્ત્રમી ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દદારો ઉપસ્થિત રહેલ. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.